

The Power of Distribution

FINANCIAL SERVICES LIMITED

MFSL/SEC/EQ/2019/56

November 1, 2019

To,

The Manager,

BSE Limited

Phiroze Jeejeebhoy Towers

Dalal Street

Mumbai - 400001

To,

General Manager

National Stock Exchange of India Limited

Exchange Plaza

Plot No. C/1, G Block

Bandra-Kurla Complex

Bandra (East)

Mumbai - 400051

Trading Symbol: MASFIN

Scrip Code: **540749**, **951920**, **952312**

Dear Sir,

Sub: Newspaper Advertisement of Intimation of Board Meeting to be held on 06th November, 2019.

Pursuant to Regulation 29 read with regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the company has given Newspaper Advertisement in One (1) English -FREE PRESS GUJARAT and One (1) Regional Language Newspaper - Gujarati - LOKMITRA about Notice of Board meeting to be held on 06th November, 2019.

Kindly take the same on your record.

Thanking you, Yours faithfully,

FOR, MAS FINANCIAL SERVICES LIMITED

RIDDHI BHAYANI

(COMPANY SECRETARY & COMPLIANCE OFFICER)

MEMBERSHIP NO.: A41206

Encl. As above

Regd. Office:

6, Ground Floor, Narayan Chambers,

B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009.

www.mas.co.in

CIN: L65910GJ1995PLC026064

\$\cdot\ + 91(O) 079 4110 6500 / 079 3001 6500

= + 91(O) 79 4110 6597,+ 91 (O) 79 4110 6561

™ mfsl@mas.co.in



Honey - Bunny set to enthrall kids at Ahmedabad One Mall!!

Ahmedabad: Honey-bunny, the fantastic duo from Honey-Bunny kaJholmaal are all set to pump up your weekend with fun-filled performances and exciting games at Ahmedabad One Mall

Adding to the festive cheers, the kids are in for a treat as not only will their favourite toons dance their hearts out, but they shall also stand a chance to participate in exciting games, activities and win some amazing gifts. Here's a chance to take a selfie with your favourite Honey - Bunny and have your celeb moment with the picture being uploaded on SONY YAY!



Website and social media platforms. (19-8)

ITIs sign partnership with 719 Private companies over last 6 months

months since its revamp by the Ministry of Skill Development Entrepreneurship (MSDE), the Dual System of Training (DST) has had a significant impact on the skilling ecosystem by partnering with 719 corporates and private partners for training programs. This is a huge jump from the 136 MoUs that were signed in the three years prior to the revamp. Interestingly, NSTI Noida alone has signed 37 of the over 700 MoUs in the past few months.

The DST scheme was introduced in 2016 with the objective of enabling industries and establishments to partner with the Government and Private ITIs for conducting training programmes towards fulfilling manpower requirements. With this aim,

Ahmedabad: In the six 719 Memorandums of Understanding (MoU) have been signed with the partners for training programs. The DST combines theoretical training from ITIs and practical training from Industry partners thereby strengthening linkages and providing handson experience to students on industries latest technologies and techniques.

The revised scheme quidelines were issued in January 2019 and are much more relaxed with greater adaptability towards industry requirements and with wider coverage of ITIs. Under the DST scheme, training is imparted to meet the industry's skilled workforce requirements. After the training, trainees are awarded National Trade Certificate (NTC) that give them an edge with regard to employability. (20-4)

JAGUAR DESIGNS ALL-ELECTRIC VISION GRAN TURISMO RACE CAR FOR GRAN TURISMO SPORT



Ahmedabad: Tokyo, Japan - Jaguar has today unveiled its first all-electric virtual sports car the Jaguar Vision Gran Turismo Coupé. The futuristic EV is set to join the grid as the latest addition to the Vision Gran Turismo line-up for the Gran Turismo series

The all-electric Jaguar Vision GT Coupé has been designed and developed from the ground up taking inspiration from the brand's incredible racing lineage. The iconic C-type and D-type influence its fearless futuristic design, while Jaguar's I-TYPE 4 Formula E and I-PACE eTROPHY racing cars provide the technical foundations for uncompromising performance.

Jaguar's team of designers were given complete creative freedom to develop the perfect proportions and beautiful surfaces of this virtual Jaguar of the future.

Julian Thomson, Jaguar Design Director, said: "This project has been completely led by our young designers and represents a once-in-a-lifetime opportunity for them to create vehicle steeped in our incredible heritage but pushing the boundaries of future design. The team have done an incredible job in creating something which is clearly identifiable as a Jaguar, inspired but not constrained – by our

Providing gamers with 750 kW of power. 1 200 Nm of torque, a 0-100 km/h time of less than 2 s and perfectly balanced handling, the Jaguar Vision GT Coupé will be on the starting grid for GT Sport fans from the November. (20-4)

Probationers of the Indian Revenue Service (Customs and Central Excise) Call on the President

New Delhi: A group of our economic frontiers. probationers of 69th batch of Indian Revenue Service (Customs and Central Excise) called on the President of India, Shri Ram Nath Kovind, today (October 30, 2019) at Rashtrapati Bhavan.

Addressing probationers, the President said that boundaries of nations are opening up to economic

cooperation. On the other hand, economic challenges are also making boundaries more crucial. IRS officers are going to be the guardians of

The President said that with the objective of making the country more self-reliant, the government has launched the Make in India initiative. IRS officers' role with

respect to it is that tax administrators should strive to provide an environment within which trade and industry can thrive. Their motto with respect to international trade should be: 'Border divides, Customs connect'. This will help transform India to a 5 trillion dollar economy.

Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at : Mahadev Offset, H-47, Ravi Estate Rustam Mill Compound Dudheswar, Ahmedabad-19. Published From: 37/ A, Rajlaxmi Tanament, Opp. Rami Vidhyalaya, Laxmipura, Gorva, Vadodara-

Married man abandons infant born from relationship with Class 11 girl away. Rathwa initially refused

girl got a new lease of life when villagers and police rescued the newborn near a canal in Chhota Udepur district village. But the little baby girl, born out of an illegitimate relationship, still faces an uncertain future.

Investigation revealed that the infant's father, a married man, had abandoned her at a canal near Tarapur village last week. The man had a relationship with a class XI girl who gave birth to the girl last

However, neither the father identified as Arvind Rathwa nor the girl and or her family want to take the responsibility of bringing up this infant. The infant's father is now

booked for abandoning her and raping her mother at Jetpur and Chhota Udepur police stations respectively.

abandoned the girl remained unidentified initially, police traced her father Rathwa who had left her there. Rathwa has not been arrested yet.

After a week-long probe when cops reached the girl's While the person who had house, it came to light that

Rathwa had taken the infant girl away after a long altercation between him and the girl's parents. "The mother herself is a minor girl, so her parents did not want to keep the child and they asked Rathwa to take the baby girl has his own child, but when he was threatened of dire consequences, he took the girl and left her near the canal," said a police official. On questioning the school

saying that he is married and

student's parents, police learnt that she and Rathwa had developed feelings for each other while travelling daily in auto-rickshaw. The duo then had physical relationship due to which the girl got pregnant, but she did not tell her parents immediately.

"Her parents are claiming that she had informed Rathwa that she had missed menstrual cycles but he did not pay much heed. Her parents finally learnt noticing the physical changes in the girl's body," the police official said. He added that since the girl is minor aged, the rape case has been

Fenesta UPVC Windows and Doors to **Tackle Extreme Weather Conditions**



Ahmedabad: Winter season signals the onset of one of the prettiest times of the year. However, blustery winds accompanied by heavy downpour play havoc with routine life during this season. But not anymore, as Fenesta Building Systems (Fenesta), a division of US \$ 1.2 bn DCM Shriram Group, has launched a complete new and high-tech range of uPVC windows and doors to tackle extreme weather conditions and meet the changing needs of Indian consumers.

The latest range includes improvised version of uPVC windows which provide

complete insulation from Rain Wind, Noise and Temperature It blocks cold waves, heavy rains and withstand high-velocity winds of up to 245 kmph without rattling the window panes, which makes them ideal for high rise buildings and heavy monsoon areas. Being made up of uPVC (Unplasticized Poly Vinyl Chloride), which is a nonconductor and does not transmit heat, these windows offer exceptional natural insulation to any building from all weather extremities. The new range of windows even keep out unwanted noise and dust due to their high quality seals and airtight triple sealing system. (18-7)

VP asks private and public sectors collaboration to provide affordable treatment

President of India, Shri M Venkaiah Naidu has called for developing a new and longlasting vaccine to combat TB, which was one of the top 10 causes of death worldwide in

Inaugurating 'The 50th Union World Conference on Lung Health' in Hyderabad today, he referred to the contention that the effect of BCG vaccine being administered for TB does not last for many years and said there was an absolute need for a booster vaccine or a new vaccine that is effective and long-lasting. The four day Conference is being attended by the delegates from 130 countries.

He expressed happiness that the Indian Government has initiated trials for testing new candidate vaccines

Calling for addressing various causes that spread TB, including poverty and overcrowding, Shri Naidu said that prevention was the most effective way to control the spread of TB and said that more efforts were needed in that direction. Lifestyle disorders Minister of State for Health and such as diabetes also increase the risk of TB, he pointed out.

Stressing the need for improved diagnostics to detect TB in organs other than lungs, he said that TB treatment saved around 58 million lives globally between 2000 and 2018 and the TB mortality rate fell by 42% during that period.

Expressing concern over the rising incidence of respiratory and lung-related diseases due to air pollution, he observed that exposure to ambient air pollution could lead to reduced lung function, respiratory infections and aggravated

Shri Naidu called for measures to arrest this pressing problem by adopting a multipronged approach to reduce emissions of harmful gases, especially which come under PM 2.5 levels.

Quoting WHO data, he said ambient (outdoor air pollution) was a major cause of death and disease globally. An estimated 4.2 million premature deaths globally are linked to ambient air pollution, mainly from heart disease, stroke, chronic obstructive pulmonary disease, lung cancer, and acute respiratory infections in children.

Lauding the government for adopting a multi-sectoral and community-led approach to eliminate TB from India by the vear 2025. Shri Naidu urged the private sector to step up its efforts towards achieving the goal of eliminating TB by actively collaborating with the

government. Stating that Government of India was in the forefront of global action to end the emergency on account of the prevalence of Lung Disease and Tuberculosis, he said that the Prime Minister, Shri Narendra Modi, has pledged a firm commitment to eradicate TB by the year 2025

Referring to the positive outcomes of initiatives such as the Revised National TB Control Program (RNTCP) that brought down TB incidence in India at an annual rate of 1.7%, the Vice President said Public and

together to reach out to more TB patients and provide them affordable treatment.

Describing Telangana as a dynamic and growing hub for innovative medical science and biomedical industry, the Vice President called upon the business leaders in the state to play a more pro-active role in supporting Research and Development in treatment, care and prevention of TB.

Observing that noncommunicable diseases like cancer, diabetes and heart attack were accounting for huge spending by households, Shri Naidu said the problem could be surmounted to a large extent by ensuring Universal Health Coverage where every individual gets quality treatment without facing any financial hardship

He said that programs such as AayushmanBharath were a step in the right direction to comprehensive provide insurance coverage to 10 crore poor and vulnerable families.

The Governor of Telangana, Dr. Tamilisai Soundararajan, Family Welfare, Government of India, Shri Ashwini Kumar Chowbey, the Minister for Health and Family Welfare, Govt Telangana,

Whereas

EtelaRajendar, Dr.Jeremiah, President of the International Union Against TB and Lung Disease, Mr.Louis Castro, Shri

"Hon'ble Governor of Telangana, Dr. Tamilisai Soundararajan, Hon'ble Minister M. Venkateshwarlu, President, of State for Health and Family Welfare, Government of India. TFCCI were among those

Eureka Forbes gives you protection from the killers in the air

at worrisome levels. In order to make Indian homes safer, Eureka Forbes Limited, India's leading health and hygiene brand, has launched its finest

purifiers to date Aeroguard AP 700 DX and Dr Aeroguard HPA 500. These are India's first air purifierswith a disease protection system and an H1N1 HEPA filter that helps prevent swine flu. The purifiers were launched keeping in mind the current air

pollution concerns in India, which include indoor pollution. The purifiers are powered by six-stagefiltration systems to tackle the new-age pollutantsand viruses.

A study by Airvisual and Greenpeace placed 15 Indian cities amongthe 20 most polluted in the world. New

SYMBOLIC POSSESSION NOTICE

The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand

notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from

Pranch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No –B3, WIFI IT Park, Wagle Industrial Estate.

Thane, Maharashtra - 400604

Ahmedabad: Air pollution is Delhi, home to more than 20 million people, was ranked at 11, making it the world's most polluted capital - ahead of Dhaka and Kabul. Another study showed that air pollution kills a child

> threeminutes. These statistics clearly show the need for home technologyto keep families safe. Mr Marzin R Shroff, MD & CEO, Eureka Forbes Limited said, "Air purifiers are no longer a luxury but

have become a necessity as per the alarming increase in the nation's air pollution levels. We have come up with

latest technology induced in these purifiers to fight the newage pollutants in the air. With this innovation, we intend to make our consumers' homes safer and pollution free." (19-10)

ETIHAD AIRWAYS 'SHARES

THE LIGHT' THIS DIWALI



Ahmedabad: In the week leading up to Diwali, guests flying Etihad Airways had a surprise in store for them at the Abu Dhabi Airport. Marking one of the India's biggest festivals, the national airline of the United Arab Emirates, celebrated with an act of sharing, inspired by the timeless tradition of exchanging gifts and sweets this season.

At the airline's home, Etihad Airways presented guests with its 'Share the Light' Diwali box at the immigration counters, check in counters and arrival area of the Abu Dhabi Airport. This unconventional festive box, featuring the traditional 'laddoos' was designed to light up when the 'mithai' was shared, thus encouraging guests to share the sweets with family, friends, fellow travellers and even a stranger.

Diwali, the Indian festival of lights, is widely celebrated across the country and sees millions attend prayers and events during the five-day festival. Completing 15 years of service to India and having over thousands of Indian travellers arriving in Abu Dhabi daily, the airline chose to make each guest feel closer to home by celebrating their most loved festival. (19-10)

Inaugurates International Conference on Ions at CSIR-NEERI, Nagpur

PUBLIC NOTICE

NOTICE is hereby given that the below mentioned Sub Broker / Authorised Person is no longer affiliat as Sub Broker / Authorised Person of Kotak Securities Limited.

of Sub Broker/Authorised Person

Please note that above mention Sub Broker (SB)/Authorised Person (AP) is no longer associated with us

Any person henceforth dealing with above mention SB/AP should do so, at their own risk. Kotak Securities Ltd. shall not be liable for any such dealing. In case of any queries for the transactions till date, Investors are requested to inform Kotak Securities Ltd. within 15 days from the date of this notification, failing which

Kotak Kotak Securities Limited. Registered Office: 27 BKC, C 27, G Block, Bandra Kurla Kotak Securities Complex, Bandra (E), Mumbai 400051. [IN: U99999MH1994PLC134051, Telephone

Trade Name | Exchange Registration Numbers

Pankhaniya BSE - AP0106730181649

t shall be deemed that there exists no queries against the above mentioned SB/AP

NSE - AP0291099081

New Delhi: The Vice "severe" air quality levels in President of India, Shri M most of the Indian cities. Venkaiah Naidu today expressed Quoting from the finding of the concern over the rising pollution levels in several parts of the country and urged scientists and researchers to come up with innovative and out-of-box solutions to combat pollution.

Inaugurating 'International Conference on Ions' at CSIR- National **Environmental Engineering** Research Institute (NEERI) in Nagpur today, he expressed concern over the "poor" or

Pankhaniya

Centre for Science and Environment's State of India's Environment (SoE) Report, 2019, he said that air pollution was responsible for 12.5 per cent of all deaths in India

Stating that environmental pollution and deterioration in the air quality was among the foremost challenges faced by the country today, Shri Naidu stressed that one could not think about building a safe.

Address of Sub Broker/

Authorised Person

730 Avirbhav Society-1 Gujra

Housing Board Road Pandesa

Surat City Surat 394221

As tha cor me	t the undersigned has tak nferred on him/ her under ntioned dates. The borrow	by the amount, notice is hereby given to the borrowe ten possession of the property described herein be Section 13(4) of the said Act read with Rule 8 of the er in particular and the public in general is hereby can the property will be subject to the charge of ICICI Bar	low in exercise of e said rules on the ationed not to dea	of powers ne below-
Sr. No.		Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch
1.	Harshita Folding Works/ Vijaykumar Aswani - 231305000387	Shop No. 107- F Block, 1st Floor, Swaminarayan Business Park , Near Narol Circle Opp. Gokulesh Petrol Pump,narol Ahmedabad- 382504/ October 25, 2019	July 01, 2019 Rs. 34,46,409.99/-	Gujarat

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: 01-11-2019 Place: Gujarat



પોર ગ્રામ પંચાયત,પાદરા મુકામઃ પોર પોસ્ટ જી.વડોદરા



Authorized Officer ICICI Bank Limited

સાલમુબારક

જગદીશ રમણભાઈ પટેલ પોર ગ્રામ પંચાયત શ્રી સ્વાતંત્રતા દિનથી આપણે સૌ સંકલ્પ કરીએ...

(૧) પાણી એ પ્રભુની પ્રસાદી છે. તેનો દુરઉપયોગ અટકાવીએ.(૨) સ્ત્રી ભ્રુણની હત્યા રોકીએ. સ્ત્રી ભ્રુણની હત્યા કરનાર તથા કરાવનાર બન્ને કાનુની અપરાધી છે.(૩) દીકરીના દન્મ નો ઉત્સવ મનાવીએ.દિકરીને ઉચ્ચ શિક્ષણ આપી સ્ત્રી સશકિતકરણ વેગવાન બનાવી એ.(૪) જન્મ મરણ નોંઘણી તથા લગ્ન નોંઘણી અતિ આનશ્યક બાબત છે. સમય મર્યાદામાં કરાવી કાનની ગંચમાંથી બચીએ.(પ) ગ્રામ સભા એ સામાજીક ઓડીટ છે.એક આર્દશ નાગરીક તરીકે ગ્રામસભામાં હાજરી આપી ગામના પ્રશ્નોનો નિકાલ કરીએ.(દ્દ) જે ગામને હોય ગંદકી-ઉકરડાથી વેર. તે ગામમાં હોય લીલા લહેર,ઘરમાં કચરા પેટી રાખવી અતિ આવશ્યક છે.(૭)જયાં વૃક્ષોની અમી છે.ત્યાં શેની કમી છે વૃક્ષો વાવો,વરસાદ લાવો.(૮) પંચાયતના વેરા તથા જમીન મહેસુલ એ સરકારી કર્જ છે તે સમયસર ભરી કર્જમુકત બની.(૯) ટપંક સિંચાય એ શ્રેષ્ઠ સિંચાય પધ્ધતિ છે.ટપક સિંચાઈ અપનાવી.સરકારશ્રી દ્રારા અપાતા અનુદાન મેળવીએ.(૧૦) ૦થી૦.૫ વર્ષના તમામ બાળકોને સરકારશ્રી દ્રારા અપાતી રોગપ્રતિકારક રસીઓઆપાવીએ.(૧૧)હંમેશા હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ. તથા ડ્રાયવીંગ સાથે દારૂના ભળવીએ.



MAS FINANCIAL SERVICES LIMITED

CIN: L65910GJ1995PLC026064 Regd. Office: 6, Narayan Chambers, Gr Floor, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380009, Gujarat Tel: 079-41106500, Fax: 079-30016597/561,

Website: www.mas.co.in E-mail: riddhi_bhayani@mas.co.in

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015("LODR"), Meeting of the Board of Directors of the Company will be held on Wednesday, November 6, 2019 inter-alia, to consider and approve Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the guarter and half year ended on September 30, 2019 and such other

Further, in accordance with Regulation 46 of LODR, the details of the aforesaid meeting are available on the website of the Company i.e. www.mas.co.in and also on the website of the stock exchanges i.e. www.nseindia.com and www.bseindia.com.

For, MAS Financial Services Limited

Membership No. A41206

Date: 30.10.2019 Riddhi Bhaveshbhai Bhayani Place: Ahmedabad **Company Secretary and Compliance Officer**

સરદાર વલ્લભભાઇ પટેલના મહત્વ અને આધુનિક યુનિફાઇડ ભારત પ્રત્યેની તેમની દ્રષ્ટિ સમજવા માટે અભિયાન શરૂ

અમદાવાદઃ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તો, લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમની ઉપદેશોને સમજવા માટે એક અભિયાન શરૂ કરવા પબ્લિક રિલેશનસ સોસાયટી ઓફ ઇન્ડિયા-અમદાવાદ ચેપ્ટર, એક્સ્ટા માર્ક્સ, રંગ બહાર, એચપી ક્રિએશન, એનઆઈએમસીજે, ટી - મેન, બેક ટ્ર બચ્ચપન, અને સ્ટ્રેટેજિક મીડિયા સર્વિસીસ જેવી અનેક સંસ્થાઓ એક સાથે જોડાયા છે.

વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મજયંતી ૩૧ ઓક્ટોબર. ૨૦૧૯ થી શરૂ થશે અને ૧૫ મી ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ તેની પુણ્યતિથિએ સમાપન થશે જેના ભાગ રૂપે, આ અને બેક ટૂબચ્ચપનાં શ્રી. કૌશલ શાહે સંસ્થાઓ વિવિધ શાળાઓ અને આ અભિયાન માટે એક સાથે હાથ સંસ્થાઓમાં ક્વિઝ અને વકતૃત્વ સ્પર્ધા મિલાવ્યા. કરશે. શ્રી વલ્લભભાઇ પટેલના જીવન પર સંશોધન અધ્યયનના અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી શ્રી આધારે અમદાવાદ અને ખેડા પ્રદેશના શાળાઓને આ અભિયાનમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવશે. બારડોલીની શાળાઓમાં પણ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે . સરદાર વલ્લભભાઇ પટેલની કે પી.આર.એસ.આઇ. સમાજમાં પુષ્યતિથિ નિમિત્તે ૧૫ ડિસેમ્બરે અર્થપૂર્ણ અભિયાન ચલાવવા માટે વકતૃત્વ સ્પર્ધાનું ભવ્ય સમાપન યોજાશે

કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ ખાતે દિવસ, મહિલા દિવસ અને તાજેતરના યોજાયેલ પત્રકાર પરિષદમાં વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણીઓ પીઆરએસઆઈ - અમદાવાદ પછી , ભારતની સ્વતંત્રતા વાર્તામાં

ઝાકઝમાળ મેળવે છે તેની સામે

પોતાની અંગત જિંદગીનો વિનીમય

ચાહે તે મહિલા હોય કે પુરુષ જેમનો

૨જી આવૃત્તિ 'બેઝિક ફર્સ્ટ પ્રેઝન્ટ્સ

ઝી એજયુર્કેર', હિન્દ્વસ્તાન ટાઇમ્સના

સમર્થનથી ફરી એક વાર સાચી અને

સમાહિતગાર કારકીર્દી નિર્ણયોની

રહી છે, ફક્ત મુખ્ય પ્રવાહમાં જ નહી,

પરંતુ તેમને વૈકલ્પિક કારકીર્દી

પસંદગીઓ કરવામાં પણ મદદ કરશે.

અને તે મુંબઇમાં જૂહુ ખાતેની તુલીપ

નવેમ્બર ૨૦૧૯ના રોજ યોજાનાર છે.

સ્વરાભાસ્કર તેણીના સ્ટોકરને હેલ્લો કહે છે

કરવો પડે છે. પરંતુ જયારે સેલિબ્રીટી અવદજાવિહોણા, નામવિહોણા અને

સ્ટોકિંગ સમાચારમાં ચમકે છે ત્યારે અજાણ્યો શખ્સ તમારા જીવનમાં

પીછો કરવામાં આવી રહ્યો હોય ત્યારે છે તેનો અનુભવ કરાવે છે. આ

તેમની સામાન્ય જિંદગીમાં વારંવાર કારણને ટેકો આપતા, સ્વરા ભાસ્કર,

સાયબર કે ફિઝીકલી પીછો કરવાના અભિનેત્રી અને ટ્રોલ ડિસ્ટ્રોયર,

બનાવો બનતા રહે છે. ભારતના જમણી પાંખની બાઈટર અને પહેલેથી

અગ્રણી સ્ટ્રીમીગ પ્લેટફોર્મ MX પ્લેયર જ ઉદાર તેણીના સ્ટોકિંગ વિશેના

તેની ઓરિજીનલ સિરીઝ – હેલ્લે અનુભવ અને તેને કેવી રીતે પાર પાડ્યું

મિની દ્વારા પોતાના સૌપ્રથમ તેના વિશે વાત કરે છે. (૧૯-૮)

ઝી લાઇવ ફેસ્ટની ૨જી આવૃત્તિ

'બેઝિક કર્સ્ટ પ્રેઝન્ટસ ઝી એજયકેર'

ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓ માટે આવી અને માતાપિતાને ચર્ચા અને સલાહ

આ ફેસ્ટિવલ ફક્ત ૮થી ૧૨ ધોરણના નિષ્ણાતો આખા પ્લેટફોર્મમાં દ્રપ

સ્ટાર હોટેલ ખાતે ૨૩ અને ૨૪ ગ્રાઉન્ડ પર લાવવાનો હેતુ ધરાવે છે.

કારકીર્દીને લગતા ધર્મસંકટ પર ધ્યાન પણ આયોજન કરશે. વધમાં ૩બરુ

કેન્દ્રિત કરવા માટે અને તેમને સલાહ અપાશે અને અંગત

સંશોધકો, ઉદ્યોગ નિષ્ણાતો અને વ્યાવસાયિક અને વર્તણુંક ટેસ્ટ પણ

શિક્ષણવિંદો સાથે એક જ છત્રની હેઠળ લેવાશે જે વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી

આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના માંધાતાઓ સાથે ઇન્ટરેક્ટિવ સત્રનું

અમદાવાદઃ ઝી લાઇવ ફેસ્ટની મદદરુપ થશે.

અમદાવાદઃ સેલિબ્રીટીઓએ તે સાયકોલોજીકલ થ્રીલર સાથે સ્ટોકિંગ



આ. અભિયાન સરદાર ચેપ્ટરના અનેક અધિકારીઓ, રંગબહારના શ્રી રાજેન્દ્ર ભગત, એક્સ્ટા માર્ક્સના શ્રી શૈશવ કાયસ્થ, એચપી ક્રિએશનના શ્રી હાર્દિક પંચોલી, ટી - મેનના શ્રી પરેશ દવે

આર.એસ.આઈ. સુબોજિત સેન, મીડિયા મિત્રોને આ અભિયાનનો પરિચય આપ્યો અને પી.આર.એસ.આઈ. અમદાવાદ ચેપ્ટરના કોર કમિટી સભ્ય શ્રી પથિક શાહે મીડિયા મિત્રોને માહિતી આપી પ્રતિબદ્ધ છે અને રાષ્ટ્રીય પીઆર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, શિક્ષક

બાબતે તમામ દર્શકોનું ધ્યાન ખેંચ્યુ છે.

ઘુસણખોરી કરે ત્યારે ખરેખર શું થાય

ચાલુ વર્ષે એજયુકેર ૨૦થી વધુ

વર્કશોપ્સ કરવા માટે અને ૧૦૦થી વર્ષ

સંસ્થાઓ, ૬૦થી વધુ વિખ્યાત

વક્તાઓ અને પેનલિસ્ટને વિદ્યાર્થીઓ

સત્રો દ્વારા માર્ગદર્શન આપવા

વધુમાં પીઢ શિક્ષણવિંદો અને ઉદ્યોગ

આ સિરીઝ તમને જયારે

સરદાર પટેલની ભૂમિકાને સમજવી મહત્વપૂર્ણ હતી. શ્રી રાજેન્દ્ર ભગત, જેમણે સરદાર પર અનેક પુસ્તકો લખ્યા છે અને અસંખ્ય નાટકોમાં સરદાર પટેલની ભૂમિકા ભજવી છે, તેમણે આ મહાન નેતાના મહત્વના લક્ષણો પર પ્રકાશ પાડ્યો અને તેમના નેતૃત્વના ગુણોને માન આપ્યું. એક્સ્ટ્રા માર્ક્સના શ્રી શૈશવ કાયસ્થએ યુવા પેઢી ને સરદાર વલ્લભભાઇ પટેલના જીવનકાળના અભ્યાસ પ્રત્યે રસ દાખવવા ક્વિઝિંગ પ્રવૃત્તિઓની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો. અભિયાનમાં

નોલેજ ભાગીદાર તરીકે, એક્સ્ટ્રામાર્કસ અને શ્રી શૈશવ ક્વિઝ પ્રક્રિયાના આયોજનમાં મહત્વપૂર્ણ ભમિકા ભજવશે. એચપી ક્રિએશનના શ્રી હાર્દિક પંચોલી ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર વલ્લભભાઇ પટેલ પર તેમના વિચારો શેર કર્યા હતા. (૧૯-૮)

ભાજપ સામેની લડાઈમાં તમામ પક્ષો અમારી સાથે આવીને સરકાર બનાવેઃ હુકા

ન્ય દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં તમામની અપેક્ષા વિરૂધ્ધ સારો દેખાવ કરીને ૧૫૮. કોંગ્રેસ અને એનસીપી ૧૦૦

સંભાળનાર પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુું કું એ પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યુ હતુ કે, જેજેપી, આઈએનએલડી એમ તમામ પાર્ટીઓને મારી અપીલ છે કે, ભાજપ

દાવો કર્યો છે.આ માટે તેમને પાર્ટી બેઠકોના દોર શરૂ થયા છે. સોનિયા એક્ટિવિટિઝમાં ભાગ લેવા અને આપવામાં આવી છે.હુકાએ કહ્યુ હતુ કે. અમારી સાથે આવશે તેમને સન્માન મળશે.હું તમામને ભેગા મળીને સરકાર બનાવવા માટે અપીલ કરુ છું.ભાજપ દ્વારા અપક્ષો પર દબાણ કરવામાં આવી રહ્યુ છે.ભાજપે પરિણામનો સામનો કરવાની હિંમત બતાવવી જોઈએ.

બોલાવવા માટે કટિબદ્ધ છે. આ ફ્રેસ્ટિવલમાં ૭૦થી વધુ ક્ષેત્રેના મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા પંકજા મુંડેની વિદ્યાર્થીઓ માટે જ તૈયાર કરાયો છે મિલીયન વિદ્યાર્થીઓ અને માતાપિતાઓને અને ૬૦૦૦ને ઓન ભાઈના હાથે જ હાર

વિધાનસભાની ચૂંટણીમાં પોતના જ ભાઈના હાથે કારમી હાર થઈ છે.

મહારાષ્ટ્રમાં ભલે શિવસેના અને ભાજપના ગઠબંધન ફરી બહુમતી સાથે સરકાર બનાવે તેવા પરિણામો આવી રહ્યા છે પણ ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેની હારથી ભાજપમાં પણ આશ્ચર્ય છે.

પરલી વિધાનસભા બેઠક પર કઝીન ધનંજય મુંડ સામે પંકજા મુંડે મેદાનમાં હતી.ધનંજય મુંડે એનસીપીના નેતા છે. પંકજાને જિતાડવા માટે ખુદ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આમ છતા પંકજાની હાર રોકી શકાઈ નહોતી.

પંકજા પાંચ વર્ષ દરમિયાન વિવાદમાં રહ્યા હતા.તેઓ દુકાળગ્રસ્ત લાતુરની મુલાકાતે ગયા ત્યારે સેલ્ફી લેવા બદલ તેમની ટીકાઓ થઈ હતી. આ બેઠક પર ધનંજય મુંડેને ૮૮૨૯૪ અને પંકજા મુંડેને ૬૦૧૭૮ મત મળ્યા છે. પણ ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેની

હારથી ભાજપમાં પણ આશ્ચર્ય છે. પરલી વિધાનસભા બેઠક પર

સિવિલ હોસ્પીટલની બ્લડ બેંકે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ૧૫૩૬૭ બ્લડ યુનિટ વેડફી નાંખ્યા

અમદાવાદઃ રાજ્યની જાહેર આવેલ બ્લડ બેંકના સત્તાધીશો એ સાડા આપવા આગળ વધી રહી છે ત્યારે મોટા પાયે નાણાંકીય ગેરરીતી, ફરજમાં બેદરકારી દાખવી, ખાનગી હોસ્પીટલોને લાભ પહોંચાડનાર જવાબદાર સામે કડક પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પીટલની બ્લડ બેંક છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ૧૫૩૬૭ બ્લડ વિગતો અંગે આજદિન સુધી તટસ્થ તપાસ અને જવાબદાર સામે ફોજદારી પગલા ભરવાની કોઈ કામગીરી થઈ

હોસ્પીટલો, બ્લડ બેંકોમાં મોટા પાયે ત્રણ વર્ષના ખબ જ મોટા પ્રમાણમાં ચાલતી ગેરરીતિ ગંભીર બાબત હોવા બ્લડ વેડફી નાંખ્યું. બીજીબાજુ સિવિલ છતાં ભ્રષ્ટાચારમાં ગળાડબ આરોગ્ય હોસ્પીટલ કેમ્પસમાં જ આવેલી વિભાગ ગેરરીતી આચરનાર પર યુ.એન. મહેતા હાર્ટ, કીડની અને પગલા ભરવાને બદલે શિરપાવ કેન્સર હોસ્પીટલમાં દર્દીઓ રીપ્લેસમેન્ટ બ્લડ માટે વલખા મારી રહ્યા છે. ત્યારે, એકસેસ બ્લડ સ્ટોક હોય ત્યારે, સરકારી સંલગ્ન બ્લડ બેંક – હોસ્પીટલને જાણ કરવાનો નિયમ છે તેમ છતા આ નિયમનો સદંતર ઊલ્લંઘન શં ખાનગી હોસ્પીટલો અને ફેક્સિ નેશન કંપનીઓને બ્લડ વેચી દેવામાં આવે છે? તે તપાસનો વિષય છે.

મુખ્ય ડૉ. એમ.ડી. ગજ્જર ને તા. ૩૧-૦૭-૨૦૧૯ ના રોજ ગુજરાત યુનિટ વેડફી નાંખ્યુ હોવાની ગંભીર સિવિલ હોસ્પીટલ રુર્લ્સ (ડીસીપ્લન નથી. અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ૦૯-૨૦૧૦ થી ૩૧-૦૭-૨૦૧૯ મુજબ છે.★

વચ્ચેના ૯ વર્ષના સમયગાળામાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિ, ખરીદીમાં ગેરરીતિ જેવી ગંભીર બાબતો સાથે ચાર્જશીટ ફટકારવામાં આવેલ હતી. આ અંગે વીજીલન્સ તપાસ ચાલતી હોવા છતાં ગંભીર ગેરરીતી અંગે આંખ આડા કાન કરીને ગેરરીતી કરનારને શીરપાવ આપવા આરોગ્ય વિભાગે ગોઠવશ કરી રહી છે.

નામદાર વડી અદાલતમાં જાહેર હિતની અરજીમાં પણ જે તે સમયે સમિતિના અહેવાલમાં સ્પષ્ટ આદેશ હતા કે. "બ્લડ કંમ્પોનન્ટ પેટે મળતા ફંડનો ઉપયોગ રક્તદાન શિબીર, સિવિલ હોસ્પીટલની બ્લડ બેંકના જાગૃતી અને થેલે સેમીયા, એચ.આઈ.વી., એઈડ્રસ જેવા રક્ત સંબંધી રોગો અટકાવવા અને તે પીડીત દર્દીને મદદ કરવા થવું જોઈએ." તે અપીલ ૧૯૭૧) અતંરત રુલ્સ-૯ ફંડનો પણ યોગ્ય ઉપયોગ થયો નથી અને રુલ્સ-૧૦ આરોગ્ય પરીવાર અને નાણાંકીય ગેરરીતિ આચારવામાં કલ્યાણના વિસ્તૃતિ પત્રથી તા. ૨૦- આવી છે. આ અંગેની ચાર્જશીટ નીચે

મહારાષ્ટ્રમાં ફરી ભગવા સરકાર, હરીયાણામાં રાજકીય સસ્પેન્સ

વિજય થયો છે. ભગવા યુતિ ફરી સત્તારૂઢ બનશે. ટ્રેન્ડમાં આ યુતિને બહુમતી મળી ચૂકી છે. જ્યારે હરીયાણામાં પળે-પળે સ્થિતિ બદલાતા રાજકીય સસ્પેન્સ સર્જાયુ છે. હરીયાણામાં એક પણ પક્ષને બહુમતી મળી નથી. આ સંજોગોમાં રાજ્યમાં ગઠબંધન સરકાર રચાશે એવા નિર્દેશો મળી રહ્યા છે. મહારાષ્ટ્રની ૨૮૮ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી તેના છેલ્લા સમાચાર મુજબ ભાજપ અને શિવસેના ભાજપને કોંગ્રેસે આંચકો આપ્યો છે. તથા અન્યો ૩૦ બેઠકો મેળવે છે. જયારે કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન હરીયાણામાં ૯૦ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં છેલ્લા સમાચાર મુજબ ભાજપ ૪૦, કોંગ્રેસ ૩૨, જેજેપી ૧૦ અને અન્ય ૭ બેઠક મેળવે છે. રાજ્યમાં જેજેપી કિંગમેકરની ભુમિકામા આવી ગઈ છે. અહીં આ સામેની લડાઈમાં અમારો સાથ આપે. પક્ષના ટેકા વગર કોઈપણ પક્ષ સરકાર હુકાએ સરાકર બનાવવવાનો રચી શકે તેવી સ્થિતિમાં નથી. દિલ્હીમાં હાઈકમાન્ડ તરફથી તમામ છુટ ગાંધી અને અમિત શાહ સક્રીય બન્યા અમુક આકર્ષક ભેટસોગાદો જીતવાનો

FICICI Bank

ક્રમ કરજદારો નું નામ / લોન એકાઉન્ટ

હર્ષિતા ફોલ્ડીંગ વર્કસ /વિજયકુમાર

પુષાઃ મહારાષ્ટ્ર વિધાનસભાની પર ભાજપ-શિવસેના અને સહયોગી પરથી એનસીપીના ડો. સુરેશ માને સામે યોજાયેલી ચંટણીમાં ફરી એક વખત પક્ષો જીતી રહ્યા હોવાથી ભાજપ- ૧૯ હજારથી વધુ મતથી જીત્યા. ભાજપ અને શિવસેનાનો ઝળહળતો શિવસેનાના સરકારનું પુનરાવર્તન એકઝીટપોલ્સમાં મહારાષ્ટ્રમાં ભાજપને નક્કી છે.

> શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી એનસીપીનું પ્રદર્શન સારૂ રહેતા કોંગ્રેસ ડેબ્યુ ઉમેદવાર આદિત્ય ઠાકરે વર્લી બેઠક હતી.

સ્પષ્ટ બહુમતી મળવાનો અંદાજ મુકાયો હતો જેમા ભાજપ - શિવસેનાના ગઠબંધનને ૧૮૮-૨૪૩ બેઠકો કરતા વધુ બેઠકો મેળવી છે. શિવસેનાના મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી

હની- બની અમદાવાદ વન મોલમાં બાળકોને રીઝવવા માટે સુસજ્જ!!

અમદાવાદઃ હની- બની કા ઝોલમાલની અદભુત જોડી હની-બની અમદાવાદ વન મોલ ખાતે મોજમસ્તીભર્યા પરફોર્મન્સીસ અને રોમાંચક ગેમ્સ સાથે તમારા વીકએન્ડમાં વધુ ખુશી ભરવા માટે

આ તહેવારની ખુશીમાં ઉમેરો કરતાં બાળકોને તેમના મનગમતાં ટુન્સ સાથે મન મૂકીને નાચવા મળશે. ઉપરાંત તેમને રોમાંચક ગેમ્સ, છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પણ મોકો મળશે. તમારા મનગમતા પરિશામમાં શરૂઆતી વલણ મુજબ હની-બની સાથે સેલ્ફી લેવાનો મોકો ૨૮૮ બેઠકો પૈકી મોટાભાગની બેઠકો પણ મળશે. ઉપરાંત સોની ૩છ૩!

સાંકેતિક કબ્જા નોટીસ

સિક્યુરાઇઝેશન રિકંસ્ટ્રક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ ઇનફોર્સ્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્યુરિટી ઇન્ટરેસ્ટ ઇન્ફોર્સમેન્ટ

૨૦૦૨ની કલમ ૧૩ (૧૨) તેની સાથે અનુચ્છેદ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહી નીચે સહી કરનાર આઈસીઆઈસીઆઈ બેંકના સત્તાવાર

અધિકારીએ નીચે જણાવેલ લોકોને માંગણા નોટીસ આપી છે. આ નોટીસ આપ્યાર્થી ૬૦ દિવસની અંદર અહી દર્શાવેલા નાણા ભરી જવા જણાવવામાં

કરજદારો નાણા ચુકવવામાં નિષ્ફળ ગયા છે. આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકારીએ અહી જણાવેલી મિલ્કતનો

પ્રતિકાત્મક કબ્જો લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાર્યવાહી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાને આથી

ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ પાસે આ મિલ્કત ટાંચમાં હોય કરજદારો અને સામાન્ય જનતાએ કોઈ પણ પ્રકારનો

મિલ્કતની વિગત /

સાંકેતિક કબ્જાની તારીખ

શોપ નં. ૧૦૭- એફ બ્લોક, ૧લો માળ, સ્વામિનારાયણ બિઝનેસ પાર્ક, નારોલ

સર્કલ પાસે, ગોકલેશ પેટ્રોલ પંપ સામે, નારોલ અમદાવાદ- ૩૮૨૫૦૪/ ર

ઉપર જણાવેલા કરજદાર(રો)/ જામીનદાર(રો)અહી બાકી નાણાં પરત કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવે છે. નહીં તો કલમ ૮ અને ૯ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ

(ઇન્ફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ની જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે.

બ્રાન્ય ઓફિસ: આઈસીઆઈસીઆઈ બેંક લી. ઓફિસ નંબર ૨૦૧-બી, ૨જો માળ

રોડ નં.૧ પ્લોટ નં.બી૩, વાઇફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટીયલ એસ્ટેટ, થાણે,



વેબસાઈટ અને સોશિયલ મિડિયા મંચો પર પિક્ચર સાથે તમારી સેલિબ્રિટી મોમેન્ટને અપલોડ કરાશ. (૧૯-૮)

ડિમાંડ નોટીસની તારીખ /

ડિમાંડ નોટીસની રકમ

ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ભારત આગળ, વર્લ્ડ બેંકે રેંકિંગમાં સુધારો કર્યો ન્યુ દિલ્હીઃ દેશનું અર્થતંત્ર નબળું બિઝનેસમાં ભારતને મળેલું રેંકિંગ પડી રહ્યું છે એવા અહેવાલો વચ્ચે ઇઝ ઉત્સાહ વધારનારૂ છે.

ઑફ ડુઇંગ બિઝનેસના રેંકિંગમાં

હતું ત્યારે ઇઝ ઑફ ડુઇંગ અણસારછે.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકારે ભારતને પીઠબળ મળ્યું હતું. વર્લ્ડ બેંકે પહેલીવાર સત્તાનાં સુત્રો ગ્રહણ કર્યાં ભારતના રેંકિંગમાં સુધારો કર્યો હતો. ત્યારે ૧૯૦ દેશોમાં ભારતનું રેંકિંગ વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ૧૪૨ હતું જે ગયા વરસે ૭૭ પર ફંડ, ભારતની રિઝર્વ બેંક વગેરેએ આવ્યું હતું અને આ વરસે દુ પર આર્થિક મંદીને જોતાં જીડીપીમાં આવ્યું છે. આ સુધારો આવનારા વધારો થવાનું અનુમાન વ્યક્ત કર્યું દિવસો આશાસ્પદ રહેશે એનો





પાવર ગ્રીડ કોરપોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કોર્પો. ઓકિસ: સૌદામની, પ્લોટ ને. રે, સેક્ટર-રેલ્, ગુરૂરોમ ન ૧૨૨૦૦૧, હિરિયાણા ટેલી: ૦૧૨૪-૨૫૭૧૭૦૦-૭૧૯ જીસ્ટર્ડ ઓકિસ: બીન્દ, કુતુબ ઇન્સ્ટીટ્યુશનલ એરિયા,કટવારિયા સરાય, નવી દિલ્હી- ૧૧૦૦૧ દ ટેલી:- ૦૧૧-૨૬૫૬૦૧૧૨,૨૬૫૬૦૧૨

www.powergridindia.com, CIN: L401010L1989G01038121

૧. સીઈઆરસી (વ્યવસાયનું સંચાલન) વિનિયમ, ૧૯૯૯ના વિનિયમ -૮૬ અને સીઈઆરસી (ટેરીફના નિયમો અને શર્તા) વિનિયમ, ૨૦૧૪ અન્વયે અંતર્ગત પરિસંપત્તી-૧:૧ નં.૨૨૦ કેવી લાઇન વાયા રેવા પુલીગ રામનગર ૨૨૦ કેવી સીકેટી ૨ લાઇન અને ૧ નં.૨૨૦ કેવી લાઇન વાયા રેવા પુલીગ બરસીતાલ દેસ સીકેટી ૨ લાઇન રેવા પુલિંગ સ્ટેશન ખાતે ૨ ૨૨૦ કેવી લાઇન વાયા રેવા પુલીગ રામનગર૨૨૦ કેવી સીકેટી ૧ લાઇન રેવા પુલિંગ સ્ટેશન ખાત ૩ ૨ એઓએસ ૨૨૦ કેવી લાઇન વાયા રેવા પુલીગ બદવાર ૨૨૦ કેવી સીકેટી ૧ અને સીકેટી લાઇન ૨ રેવા પુલીંગ સ્ટેશન અને ૧ નં.૫૦૦ એમવીએ,૪૦૦-૨૨૦ કેવી આઇસીટી ૩ તેની સાથે જાડાયેલુ ૪૦૦ કેવી અને ૨૨૦ કેવી ટ્રાન્સફોર્મર રેવા પુલીંગ સ્ટેશન ટ્રાન્સમીશન સીસ્ટમ નીચે મેગા સોલર પાર્ક (૭૫૦ એમવી) રેવા જિલ્લા મઘ્યપ્રદેશ પશ્ચિમ પ્રદેશમાં તા ૩૧.૦૩.૨૦૧૯ સુધીની અવધિ માટે ટ્રાંસિમશન ટેરિફના નિર્ધારણ માટે અનુમોદન.

૨. ઉપર દર્શાવેલ ટ્રાંસમિશન સિસ્ટમના લાભાર્થી છે : (ક) મધ્ય પ્રદેશ પાવર મેનેજમેંટ કોરપોરેશન લિ. (ખ) વીજળી વિભાગ, દમણ અને દીવ પ્રશાસન, દમણ (ગ) ગજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. વડોદરા (ઘ) વીજળી વિભાગ, ગોવા સરકાર, પશજી (ડ) વીજળ વિભાગ, દાદરા નગર હવેલી પ્રશાસન, સિલવાસા (ચ) મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કં. લિ., મુંબઈ (છ) છત્તીસગઢ રાજ્ય વીજળી બોર્ડ, કાયપુર (જ) મધ્ય પ્રદેશ ઔદ્યોગિક કેન્દ્ર વિકાસ નિગમ (ઇન્દૌર) લિ ઇન્દૌર.(આઇ) મહારાષ્ટ્ર રાજ્ય વિજળી ટ્રન્સમીશન કોર્પોરેશન લી. (જે) ડીએનએચ પાવર ડીસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લી. (કે)મધ્યપ્રદેશ પાવર ટ્રાન્સમીશન કોર્પોરેશન લી મુબઇ (એલ) રેવા અલ્ટ્રા મેગા સોલર લી.

પ્રાધિકરણ જેણે મુડી લાગતને અનુમોદિત કરેલ : નિદેશક મંડલ, પાવરગ્રીડ શિડ્યુલ ડિઓસીઓ ૧૫.૦૩.૨૦૧૭

એસેટ	નં. ઓક બાય્સ	એપ્રોશીયેનેડ એપ્રૂવ્ડ કેપીટલ કોસ્ટ (રૂા. લાખમાં)	ડિઓસીઓ ઉપર એસ્ટી. કેપીટલ કોસ્ટ (રૂા. લાખમાં)	૨૦૧૪-૧૯ માટે ટેરીફ ટેરીફ બ્લોક (રૂા. લાખ માં)				
(ડિઓસીઓ)				ર0૧૪- ૧૫	२०१५ १ ह	२०१ <i>६</i> १७	२०१७ १८	२०१८- १ <i>७</i>
એસેટ૧. ૨૫.૦૭.૨૦૧૮	૨૨૦કેવી બાય૨(એઆઈએસ)	६६१.५६	૪૦૫.૬૨	-	-	-	-	११७.०५
એસેટર. ૧૬.૧૦.૨૦૧૮	૨૨૦કેવી બાય૧(એઆઈએસ)	૫૪૮.૫૩	૩૫૨.૭૨	-	-	-	-	૫૪.૦૬
એસેટ૩. ૨૨.૧૧.૨૦૧૮	૨૨૦કેવી બાય૨(એઆઈએસ)	हह१.५ह	૪૩૧.૧૨	-	-		-	૯૪. ૫૯
એસેટ૪. ૦૮.૦૨.૨૦૧૯	૪૦૦ કેવીબાય૧એસ્વઈએસ) ૨૨૦કેવી બાય૧(એસઈએએસ	રપરપ.૮૦	₹3८€.00	-	-	-	-	૭૬.૧૫

૪. ટેરીફ્રના નિર્ધારણ માટે કરવામાં આવેલ અરજીની એક નકલ અરજીકર્તાની વેબસાઇટડ્રેwww.powergridindia.com ઉપર પ્રકાશિત કરેલ છે.

પ. આવેદનમાં નિહિત ટેરીફના નિર્ધારણ માટે પ્રસ્તાવ ઉપર લાભાર્થી સમેત કોઈ પણ વ્યક્તિ દ્વારા સલાહ અને વાંધાઓ, જે પણ હોય, અરજીકર્તાએ આની કારપોરેટ કચેરી 'સૌદામિની', પ્લોટ નં. ૨ સેક્ટર-૨૯, ગુડગાંવ- ૧૨૨૦૦૧, હરિયાણામાં એક કોપી સાથે, સચિવ, કેન્દ્રીય વિદ્યુત વિનિયામક આયોગ, ત્રીજા અને ચૌથા માલ, ચંદ્રલોક બિલ્ડિંગ, જનપથ, નવી દિલ્હી- ૧૧૦ ૦૦૧ (અથવા બીજા સરનામે જયાં આયોગની કચેરી સ્થિત છે)ને આ નોટીસના પ્રકાશનના ૩૦ દિવસની અંદર

સ્થળ : ગુડગાંવ તારીખ: ૩૧.૧૦.૨૦૧૯

જફરૂલ હુસૈન ડીજીએમ (વાણિજિયક)

એ મહારત્ન પીએસય

પનામા પેટ્રોકેમ લીમીટેડ

૨જી. ઓફિસ: પ્લોટ નં.૩૩૦૩, જીઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર, ૩૯૩૦૦૨ કોર્પો. ઓફિસ: ૪૦૧, અઝા હાઉસ, ૧૪, ટર્નર રોડ, મુંબઈ-૪૦૦ ૦૫૦. વેબસાઇટ: www.panamapetro.com સીન નં.: L23209GJ1982PLC005062 ફોન : ૯૧-૨૨-૪૨૧૭૭૭૭૭, ઈમેલ :cs@panamapetro.com

આથી અહી નોટીસ આપવામાં આવે કે સેબી(લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિકવાયરમેન્ટસ રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪૭ના નિયમ ૨૯ વાંચતા કંપનીએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ નવેમ્બર,૨૦૧૯ નારોજ ઇન્ટર અલીયામાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંતિમ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનાએપ્રૂલ

સ્ટેન્ડલોન અને કન્સોલીડેટેડ અનઓડીટેડ નાણાંકીય પરિણામ ની યોગ્ય ચર્ચા માટે યોજાશે આ ઇન્ટીમેશન કંપની ની વેબસાઇટ www.panamapetro.com અને સ્ટોક એક્સચેંઝની વેબસાઇ www.bseindia.com અને www.nseindia.com પર ઉપલબ્ધ છે.

> બોર્ડના હકમ વતી પનામા પેટ્રોકેમ લીમીટેડ

સ્થળ : મુંબઈ તારીખઃ ૩૦-૧૦-૨૦૧૯

ગાયત્રી શર્મા કંપની સેક્રટરી એન્ડ કમ્પ્લાયંસ ઓફિસર

PUBLIC NOTICE Sub Broker **Exchange Registration Numbers** Address of Sub Broker/ Authorised Person Person Nam 730 Avirbhav Society-1 Gujrat NSE - AP0291099081 Vipul S Vipul S Housing Board Road Pandesa Pankhaniya BSE - AP0106730181649 Pankhaniya Surat City Surat 394221

Please note that above mention Sub Broker (SB)/Authorised Person (AP) is no longer associated with us Any person henceforth dealing with above mention SB/AP should do so, at their own risk. Kotak Securitie Ltd. shall not be liable for any such dealing. In case of any queries for the transactions till date, Investors are requested to inform Kotak Securities Ltd. within 15 days from the date of this notification, failing which it shall be deemed that there exists no queries against the above mentioned SB/AP.

kotak* Kotak Securities Limited. Registered Office: 27 BKC, C 27, G Block, Bandra Kurla Kurla Kotak Securities Complex, Bandra (E), Mumbai 400051. CIN: U99999MH1994PLC134051, Telephone No.: +22 43360000, Fax No.: +22 67132430. Website: www.kotak.com / www.kotaksecurities.com. Correspondence Address: Infinity IT Park, Bldg. No 21, Opp. Film City Road, A K Vaidya Marg, Malad (East), Mumbai 400097. Telephone No: 42856825, SEBI Registration No: INZ000200137 (Member of BSE, NSE, MSE, MCX & NCDEX), AMFI ARN 0164, PMS INP000000258, and Research Analyst INH000000586. NSDL/CDSL: IN-DP-NSDL-23-97.



MAS FINANCIAL SERVICES LIMITED

CIN: L65910GJ1995PLC026064 Regd. Office: 6, Narayan Chambers, Gr Floor, B/h Patang Hotel Ashram Road, Ahmedabad-380009, Gujarat Tel: 079-41106500, Fax: 079-30016597/561,

Website: www.mas.co.in E-mail: riddhi_bhayani@mas.co.in

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015("LODR"), Meeting of the Board of Directors of the Company will be held on Wednesday, November 6, 2019 inter-alia, to consider and approve Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the guarter and half year ended on September 30, 2019 and such other

Further, in accordance with Regulation 46 of LODR, the details of the aforesaid meeting are available on the website of the Company i.e. www.mas.co.in and also on the website of the stock exchanges i.e. www.nseindia.com and www.bseindia.com.


For, MAS Financial Services Limited

Date: 30.10.2019 Place: Ahmedabad

Riddhi Bhaveshbhai Bhayani **Company Secretary and Compliance Officer** Membership No. A41206

ન્યુ દિલ્હીઃ મહારાષ્ટ્ર ભાજપનુ મોટુ માથુ ગણાતા પકંજા મુંડેની

કઝીન ધનંજય મુંડ સામે પંકજા મુંડે મેદાનમાં હતી.ધનંજય મુંડે એનસીપીના નેતા છે. પંકજાને જિતાડવા માટે ખુદ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો.



બોક્ટોબર, ૨૦૧૯.



પોર ગ્રામ **પંચાયત શ્રી**

કરનાર તથા કરાવનાર બન્ને કાનૂની અપરાધી છે.(૩) દીકરીના દન્મ નો ઉત્સવ મનાવીએ.દિકરીને ઉચ્ચ શિક્ષણ આપી સ્ત્રી સશકિતકરણ વેગવાન બનાવી એ.(૪) જન્મ મરણ નોંઘણી તથા લગ્ન નોંઘણી અતિ આનશ્યક બાબત છે. સમય મર્યાદામાં કરાવી કાનુની ગુંચમાંથી બચીએ.(પ) ગ્રામ સભા એ સામાજીક ઓડીટ છે.એક આર્દશ નાગરીક તરીકે ગ્રામસભામાં હાજરી આપી ગામના પ્રશ્નોનો નિકાલ કરીએ.(૬) જે ગામને હોય ગંદકી-ઉકરડાથી વેર. તે ગામમાં હોય લીલા લહેર,ઘરમાં કચરા પેટી રાખવી અતિ આવશ્યક છે.(૭)જયાં વૃક્ષોની અમી છે.ત્યાં શેની કમી છે વૃક્ષો વાવો,વરસાદ લાવો.(૮) પંચાયતના વેરા તથા જમીન મહેસુલ એ સરકારી કર્જ છે તે સમયસર ભરી કર્જમુકત બની.(૯) ટપંક સિંચાય એ શ્રેષ્ઠ સિંચાય પધ્ધતિ છે.ટપક સિંચાઈ અપનાવી.સરકારશ્રી દ્રારા અપાતા અનુદાન મેળવીએ.(૧૦) ૦થી૦.૫ વર્ષના તમામ બાળકોને સરકારશ્રી દ્રારા અપાતી રોગપ્રતિકારક રસીઓઆપાવીએ.(૧૧)હંમેશા હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ. તથા ડ્રાયવીંગ સાથે દારૂના ભળવીએ.



પોર ગ્રામ પંચાયત,પાદરા મુકામઃ પોર પોસ્ટ જી.વડોદરા



ઓથોરાઈઝડ ઓફિસર

આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ

સાલમુબારક

જગદીશ રમણભાઈ પટેલ સ્વાતંત્રતા દિનથી આપણે સૌ સંકલ્પ કરીએ...

(૧) પાણી એ પ્રભુની પ્રસાદી છે. તેનો દૂરઉપયોગ અટકાવીએ.(૨) સ્ત્રી ભ્રુણની હત્યા રોકીએ. સ્ત્રી ભ્રુણની હત્યા

સુમાહિતગાર નિર્ણયો લેવામાં માટે સહાય કરશે. -મૌલાનાઓની સમસ્યા અને વિપક્ષનો એજન્ડા સમજથી બહાર, રાજીનામું નહીં આપુઃ ઈમરાન ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સમર્થન મળી રહ્યું છે.

પ્રધાનમંત્રી ઈમરાનખાને બુધવારે વિપક્ષના જમીયત ઉલેમા ઈસ્લામ ફ્રજલ અને મૌલાનાઓના વિરોધને નહીં. વિપક્ષે ઈમરાન સરકાર સામે આપવાનો કોઈ પ્રશ્ન નથી અને હું રાજીનામું આપવા પણ માગતો નથી. વિપક્ષ અને મૌલાનાઓના ધરણા એક

ઈમરાને કહ્યું મને મૌલાનાઓની સમસ્યા અને વિપક્ષનો એજન્ડા બિલકુલ સમજમાં આવ્યો નથી. લઈ જવાબ આપ્યો છે. ઈમરાને કહ્યું વિપક્ષના નેતા ફજલુર રહેમાનનો છે કે મૌલાનાઓની સમસ્યા અને વિરોધ એક કાવતરું છે, જેને બીજી વિપક્ષનો એજન્ડો સમજથી બહાર છે. શક્તિઓનું સમર્થન મળી રહ્યું છે. તે કોઈ દબાણમાં રાજીનામું આપશે રહેમાને આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીમાં ગેરરીતિને લીધે ઈમરાન વિરોધ વ્યક્ત કરીને આગામી સરકાર બની છે. મીડિયા અહેવાલો મહિનામાં આઝાદીની માર્ચ કાઢવાની પ્રમાણે ઈમારને વિપક્ષને સ્પષ્ટ જાહેરાત કરી છે. ઈમરાને પત્રકાર શબ્દોમાં કહ્યું છે કે માર્ચ દરમિયાન પરિષદમાં કહ્યું હતું કે મારે રાજીનામુ કાયદાનું ઉલ્લંઘન સહન કરી શકાશે નહીં. વિપક્ષે ઈમરાન સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને આગામી મહિનામાં આઝાદીની માર્ચ કાઢવાની કાવતરું કહ્યું છે, જેને વિદેશી નેતાઓનું જાહેરાત કરી છે.

> Printed & Published by Mayur C. Bhatt on behalf of Kalyani Pub. Pvt. Ltd Printed at: Mahadev Offset, H-47, Ravi Estate Rustam Mill Compound Dudheswar, Ahmedabad-19, Published From: 37/ A, Rajlaxmi Tanament, Opp. Rami Vidhyalaya, Laxmipura, Gorva, Vadodara-